

મકતબા જાફરીયા નોલેજ એન્ડ રિસર્ચ એકેડમી ખાતે સતત ત્રણ વર્ષથી 'Trade Fair' ને

મળી રહેલ પ્રશંસનીય પ્રતિસાદ

હાજર પીર સૈયદ મુજહિદ હુસૈન બાવા સાહેબની દુઆ અને હિદાયત તથા અહમદ વિકાસ મંડળના અકળ પ્રયાસોથી મકતબા જાફરીયા નોલેજ એન્ડ રિસર્ચ એકેડમીમાં સતત ત્રણ વર્ષથી યોજાઈ રહેલ 'Trade Fair' ને આ વર્ષે પણ સરાહનીય પ્રતિસાદ મળ્યો હતો. મકતબા જાફરીયા ખાતે ૨૧ થી ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ સુધી Trade Fair-2018 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં. આ સ્ટોલમાં પ્રદર્શનની સાથે સાથે વેચાણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્ટોલમાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ તથા તેની એસેસરીઝ, નાસ્તા, સ્વીટ્સ, નમકીન જેવી ખાણી-પીણીની વસ્તુઓ, સોફ્ટવેર તથા ઈન્ટરનેટ વિશેની માહિતી, સ્ત્રીઓ માટે ગારમેન્ટ્સ, જવેલરી તથા શણગારની સામગ્રી, ધાર્મિક કિતાબોનું વેચાણ, હજ તથા ઉમરાહનું માર્ગદર્શન, સ્ટીલની બનાવટો, સિરામીક આઈટમો, વિવિધ પ્રકારના અત્તર, લોબાન, સૂરમા, મુસ્સ્લા વિગેરે, ઓટોમોબાઈલ્સને લગતી એસેસરીઝ, પેઈન્ટીંગ અને કેલીગ્રાફી, વિવિધ પ્રકારની એલ.ઈ.ડી.લાઈટ અને ઈલેક્ટ્રિક વસ્તુઓ, પ્લાયવૂડ એન્ડ હાર્ડવેર, હાર્ટી માર્ટ દ્વારા દરેક પ્રકારની ઘરવપરાશની ચીજવસ્તુઓ, હોમ ડેકોર વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ટ્રેડ ફેરના મુલાકાતીઓ ખાણી-પીણીની મજા માણી શકે તે માટે પણ ફૂડ-ઝોનની અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં લગભગ ખાણી-પીણીનાં ૪૦ જેટલાં સ્ટોલ લગાવવામાં આવ્યા હતાં. સતત બે વર્ષથી ટ્રેડ ફેરનાં સંચાલન અને કામગીરીમાં પ્રશંસનીય કામ કરનાર હાજી ડી.વી.અધારીયા જાફરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તથા આઈ.ટી.શેલીયા જાફરી બી.સી.એ. કોલેજનાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણે આ વર્ષે પણ ટ્રેડ ફેરને સફળ રીતે સંચાલિત કરવા માટે બીહું ઝડપ્યું હતું. આર્ટ્સ એન્ડ કોમર્સ અને બી.સી.એનાં બે-બે વિદ્યાર્થીઓને દરેક સ્ટોલ પર ઊભા રાખવામાં આવ્યા હતાં. જેથી તેઓ વેપાર, ગ્રાહક સાથેના વર્તનની સમજ મેળવી શકે અને સાથે-સાથે ઈસ્લામમાં વેપારનાં નિયમો અંગે માહિતી પ્રાપ્ત કરી શકે. સ્ટોલનો સમય પૂરો થયા બાદ મકતબાના પ્રાંગણમાં રોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવતા હતા. જેમાં તારીખ ૨૨/૦૧/૨૦૧૮ ના સોમવારના ટ્રેડ ફેરના બીજા દિવસે જાફરી હાયર સેકન્ડરી સ્કૂલના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. ૨૩/૦૧/૨૦૧૮ મંગળવાર બોસ્તાને તીફ્લાનના નાના ભૂલકાઓ દ્વારા ડ્રામા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સરસ રજૂઆત કરવામાં આવી હતી. ૨૪/૦૧/૨૦૧૮ બુધવારે એલ.આઈ.સી. ડીપાર્ટમેન્ટ અને ડી.સી.બી.બેંક તરફથી મકતબા જાફરીયામાં અભ્યાસ કરતાં દરેક ધોરણના બેસ્ટ વિદ્યાર્થીઓને ટ્રોફી અને સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતાં. ૨૫/૦૧/૨૦૧૮ ગુરુવારે જાફરી સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. ૨૬/૦૧/૨૦૧૮ શુક્રવારના રોજ ઝાકીરાને આલે રસૂલની ટીમ જેમાં (૧) સલમાનભાઈ મુખી (હેદરપુરા) (૨) આબીદ અલી માણસીયા (જેઠીપુરા) (૩) ખાદીમભાઈ નાન્દોલીયા (મેતા) (૪) હસનઅબ્બાસ ચારોલીયા (સેદ્રાણા) (૫) મોહસીન અલી (જાફરીપુરા) (૬) અહેસાન અલી કડીવાલા (સેવાલાણી) (૭) હસન અલી મોમીન (કઠોર) (૮) બાકર અલી (હેદરપુરા) (૯) સાકીર અલી (સેવાલાણી) (૧૦) ગુલામ અબ્બાસ (જેઠીપુરા) (૧૧) નજર અબ્બાસ (ઈલોલ) (૧૨) હસન અબ્બાસ (મેતા) (૧૩) મંજુર મુહમ્મદ ગાંધી (કિસીમ્પા) સામેલ છે તેમણે જનાબ કામરાન હુસૈન જાફરી સાહેબ દ્વારા લિખિત મન્કેબત રજૂ કરી હતી. તેમજ જનાબે ફાતેમા(સ.અ.) ની શાનમાં મન્કેબત રજૂ કરી હતી. જે સાંભળીને ઉપસ્થિત લોકો ઝૂમી ઉઠ્યા હતાં.

બતાઉં કેસે કિ ક્યા કદ્ર વ શાન ઝહરા હૈ?

વો ફાતેમા(અ.) હૈ કિ જો મુસ્તુફા(સ.અ.વ) કા ટુકડા હૈ

હસન(અ.) હુસૈન(અ.) કિ માँ મુર્તુઝા(અ.) કિ ઝૌજ હૈ

તેમજ...

ફાતમા ઝહરા(સ.અ.) યે તેરી તરબીયત કિ શાન હૈ

બચ્યા બચ્યા તેરે ઘર કા બોલતાં કુરાન હૈ

બાપ સે પહેચાન હર બેટી કી હોતી હૈ મગર

તું વો બેટી હૈ તેરે જો બાપ કી પહેચાન હૈ.

પેશ કર્યું હતું. ૨૭/૦૧/૨૦૧૮ શનિવારે પણ ઝાકીરાને આવે રસૂલની ટીમ દ્વારા અલી(અ.) ની મુહબ્બત અને શાનમાં જનાબ કામરાન હુસૈન જાફરી સાહેબ દ્વારા લિખિત મન્કેબત વ્યક્ત કરી હતી. જેને સાંભળીને પ્રેક્ષકોએ અલી(અ.) માટે પોતાની મુહબ્બત ઝાહિર કરી હતી.

દહેક્તી ધૂપમેં સાયા અલી(અ.) વલીઉલ્લાહ

કદમ કદમ પે સહારા અલી(અ.) વલીઉલ્લાહ

હૈ હર નબી(અ.) ક વઝીફા અલી(અ.) વલીઉલ્લાહ

વલી વલીને પુકારા અલી(અ.) વલીઉલ્લાહ

દહેક્તી ધૂપમેં સાયા અલી(અ.) વલીઉલ્લાહ.....

ખુદા સે માંગતે હૈ ઓર નબી સે માંગતે હૈ

હૈ જિસ કે હાથમેં સબ કુછ ઉસી સે માંગતે હૈ

મગર ખુદા કી કસમ યે ભી એક હકીકત હૈ

મુશીબતોમેં મદદ હમ અલી(અ.) સે માંગતે હૈ.

કદમ કદમ પે સહારા અલી(અ.) વલીઉલ્લાહ.....

સાંભળીને લોકોનો હુઝુમ ઝૂમી ઉઠ્યો હતો. અલી(અ.) ની મુહબ્બત સ્પષ્ટ વ્યક્ત થઈ રહી હતી ગ્રામજનોએ આખો દિવસ ટ્રેડ ફેરની મજા માળ્યા બાદ રોજ રાત્રે આવા પ્રોગ્રામ્સનો લુટ્ફ ઉઠાવ્યો હતો. બી.સી.એ.ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ગણતરી મુજબ લગભગ ૧,૫૧,૬૩૪ મુલાકાતીઓએ ટ્રેડ ફેરનો આનંદ માળ્યો હતો. અહમદ વિકાસ મંડળ તરફથી તમામ સ્ટોલ ધારકોને મોમેન્ટો આપવામાં આવ્યા હતાં. આમ ટ્રેડ ફેર સફળતાપૂર્વક સમાપ્ત થયો હતો. વિવિધ ગામોમાંથી મકતબાના પ્રાંગણમાં પધારેલ ગામ લોકોએ ટ્રેડ ફેરના છેલ્લાં દિવસ સુધી મકતબા પરિવારને સાથ અને સહયોગ આપ્યો હતો જે બદલ મકતબા પરિવાર તમામ ગ્રામજનોનો આભારી છે.

સંકલન: મોહસીનાબાનું આઈ.બુખારી